

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામે જરૂરિયાતમંદ રહેવાસીઓને 10,000 પાઉન્ડથી વધારે ઊપજ પૂરી પાડી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 20, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનનો બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ હવે પૂરો થવાની સાથે, એપ્રિલથી ઓક્ટોબર 2020 સુધીમાં જરૂરિયાતમંદ રહેવાસીઓને 10,000 પાઉન્ડથી વધારે ઊપજનું દાન કરવામાં આવ્યું છે.

વોડર્સ 2 અને 6 નાં સીટી કાઉન્સિલર ડગ વિલ્લન્સે (Doug Whillans) પ્રમુખપદ સંભાળીને, અને શહેરના પાર્ક્સ એન્ડ મેઇન્ટેનન્સ એન્ડ ફોરેસ્ટરી ડિવિઝને જરૂરી સગવડ પૂરી પાડીને, COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ કેનેડામાં પોતાના પ્રકારનો પહેલો કાર્યક્રમ એપ્રિલ 15 નાં રોજ શરૂ થયો હતો. તે હાલના કમ્યુનિટી ગાર્ડન્સ પ્રોગ્રામનું વિસ્તરણ છે.

આ કાર્યક્રમે [મેયરના COVID-19 સોશિયલ સપોર્ટ ટાર્ક ફોર્સ](#) માટે ખાદ્યપદાર્થોના સંસાધનો પૂરા પાડ્યા, જેનાથી બ્રેમ્પટનના નબળા સમુદાયો માટે જરૂરી સામાજિક સહાયતા સગવડમય બની છે.

બધાં બ્રેમ્પટનવાસીઓ માટે ખુલ્લા, આ કાર્યક્રમે રહેવાસીઓને માટી, બિયારણોના પેકેજીસ, અને તેઓને નવા બગીચાઓ વિકસાવવાને સંબંધિત સલાહ પૂરી પાડી. એપ્રિલથી ઓક્ટોબર સુધી, રહેવાસીઓએ પોતાના બેંકયાર્ડ ગાર્ડનમાં ઊપજ મેળવી, જેમાં કેટલાક રહેવાસીઓએ પાક પોતાના માટે રાખ્યો અને અન્ય રહેવાસીઓએ સ્થાનિક ફૂડ બેંક્સ અને નાઈટ્સ ટેબલ, રિજનરેશન, ખાલસા એઈડ અને યુનાઈટેડ શિપ્સ સહિતની સામુદાયિક સંસ્થાઓને દાનમાં આપ્યો.

જરૂરિયાતમંદ રહેવાસીઓને તાજી ઊપજથી સહાયતા કરવા ઉપરાંત, આ પર્યાવરણને અનુકૂળ પહેલે રહેવાસીઓને COVID-19 દરમિયાન સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા, અને બ્રેમ્પટનવાસીઓને ઘરે કરવા જેવી પ્રવૃત્તિ પૂરી પાડીને રહેવાસીઓના માનસિક આરોગ્યને ટેકો પૂરો પાડ્યો. પહેલી વાર કામ કરતા ગાર્ડનર્સ માટે તે બગીચાકામ વિશે શીખવાની અને નવો શોખ અજમાવવાની તક પણ રહી હતી.

સીટી ઓફ બ્રેમ્પટન આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ પોતાના સહાયકો સ્કોટ્સ (Scotts), મેટામી હોમ્સ, પેરેડાઈઝ ડેવલપમેન્ટ્સ, TACC હોલબોર્ન કોર્પોરેશન, અને ફિલ્ડગેટ ડેવલપમેન્ટ્સનો આભાર માને છે.

આંકડાઓ જોતા

- કાર્યક્રમની શરૂઆતના ત્રણ દિવસમાં, 6,000 રહેવાસીઓએ નોંધણી કરાવી હતી.
- 45 થી વધારે સ્વયંસેવકોએ સહભાગીઓને મદત બિયારણ વિતરણમાં સહાયતા કરવા 490 ક્લાકો સુધી કામ કર્યું હતું.
- કર્મચારીગણ અને સ્વયંસેવકોએ સહભાગીઓને 3,057 યાર્ડ્સ જેટલો માટીનો મોટો જથ્થો; 8,553 બેગ્સ ભરેલી માટી; અને 15,162 પેકેટ્સ જેટલું બિયારણ વિતરણ કર્યું હતું.

અવતરણો (ક્વોટ્સ):

“અમે બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામને અને કાઉન્સિલર વિલ્લન્સની આગેવાનીને આપ્યથજનક પ્રતિસાદ જોયો, અને અમે કેનેડામાં તેના જેવી પ્રથમ પહેલ બ્રેમ્પટનમાં લાવીને ચેમ્પિયન બનવા બદલ ગૌરવ અનુભવીએ છીએ, જે નજીકના અને દૂરના શહેરો માટે પ્રેરણા સમાન છે. COVID-19 સોશિયલ સપોર્ટ ટાર્ક ફોર્સે મુશ્કેલભર્યા સમય દરમિયાન નાઈટ્સ ટેબલ અને રિજન મારફતે નબળા બ્રેમ્પટનવાસીઓને જરૂરી

ખાદ્યપદાર્થોની સહાયતા પૂરી પાડી, અને ઊપજ વિકસાવનાર અને દાન આપનાર દરેક વ્યક્તિએ આપણી ફૂડ બેંક્સ પરનું દબાણ ઘટાડ્યું હતું, આપણાં પર્યાવરણને ટેકો આપ્યો, અને આપણને સૌને ગૌરવભર્યો અનુભવ કરાવ્યો.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણાં માટે પહેલો બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ બ્રેમ્પટનમાં એક વિશાળ સફળતા હતી. અમે હજારો રહેવાસીઓને બિયારણ અને માટી આપી, જેનાથી જરૂરિયાતમંદ રહેવાસીઓને 10,000 થી વધારે પાઉન્ડની ઊપજ પૂરી પાડી શકાઈ. હું રમત બદલી નાખતી પહેલનો ભાગ બનનાર દરેકે દરેક રહેવાસી અને ધંધાનો આભાર માનવા ઈચ્છું છું, જે પહેલે દરેક વ્યક્તિને બગીચાકામ કરવા, આઉટડોર્સનો આનંદ માણવા, અને આ વર્ષે આપણાં સમુદાયને કંઈક પરત આપવા પ્રોત્સાહિત કર્યા.”

- ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી કર્મચારીઓએ બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામનો અમલ કરવા મહેનતભરી કામગીરી કરીને આપણાં સમુદાય માટે પ્રચંડ કટિબદ્ધતા અને સંભાળ દેખાડી છે, અને અમે પરિણામો જોઈને આનાથી વધારે પ્રભાવિત થઈ શકતા નથી. બ્રેમ્પટન એક ગ્રીન સીટી છે, જે કાઉન્સિલની મહત્વની અગ્રતા પરિભાષા છે, અને આ કાર્યક્રમે બ્રેમ્પટનમાં રહેવાસીઓને સક્રિય રાખ્યા છે અને વ્યક્તિઓ અને કુટુંબોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ આવી જ એક ચરિયાતી પહેલ હતી. અમે સેવા આપીએ છીએ તેવા નબળા કુટુંબો, વ્યક્તિઓ અને વડીલોમાંથી, ઘણાંને આરોગ્યલક્ષી ચિંતાઓ સતાવી રહી છે. તાજા ફળો અને શાકભાજી તેઓને સારું આરોગ્ય જાળવવામાં મદદરૂપ થવા અનિવાર્ય છે. ગાર્ડન પ્રોગ્રામ એક મૂલ્યવાન સંસાધન હતું જેનાથી ખાદ્ય પદાર્થોની ઉણપ ધરાવતા ઘરબારોને બહુ જરૂરી ઊપજ પૂરી પાડી શકાઈ હતી.”

- એની બાયોની (Annie Bynoe), એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર, નાઈટ્સ ટેબલ

“સીટી ઓફ બ્રેમ્પટનના બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામથી એક ચરિયાતી સફળતા જોવા મળી હતી. તાજા ઊપજ જે રિજનરેશન આઉટરીચ સમુદાયને મળી તેનો સીધો પ્રભાવ બ્રેમ્પટનવાસીઓના જીવન પર પડ્યો હતો જેઓ આપણાં ભોજન કાર્યક્રમ અને અમારી ઈમરજન્સી ફૂડ બેંક સુધી પહોંચી શક્યા. આપણાં રહેવાસીઓને સહભાગી થવા પ્રોત્સાહિત કરવા સીટીએ દેખાડેલું દૂરદેશીપણું બદલ અમે ખરેખર આભારી છીએ.”

- ટેડ બ્રાઉન (Ted Brown), CEO, રિજનરેશન આઉટરીચ કમ્યુનિટી

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca